

(બ) X લિ નું વેચાણ રૂ.1,70,000 છે કાચો નફો રૂ.8,000 છે આખર સ્ટોક રૂ.42,000 છે અને શરૂઆતનો સ્ટોક રૂ. 22,800 છે તો સ્ટોક ગુણોત્તર ગણો. (5)

(ક) કંપનીનો સંચાલન ગુણોત્તર 80% છે અને વેચાણ રૂ.2,50,000 છે વેચાણ પરત રૂ.25,000 છે અને સંચાલન ખર્ચ રૂ.12,500 છે તો વેચેલમાલની પડતર શોધો. (5)

પ્રશ્ન-૪ પ્રકાશ લિ. ના પાકા સરવૈયા નીચે મુજબ છે. (15)

જવાબદારી	2015	2016	મિલકતો	2015	2016
ઈક્વિટી શેરમૂડી	1,20,000	1,50,000	જમીન-મકાન	90,000	1,50,000
૧૦% પ્રેફરન્સ	60,000	60,000	મશીનરી	60,000	30,000
શેરમૂડી			ફર્નિચર	30,000	30,000
સામાન્ય અનામત	48,600	54,600	સ્ટોક	30,000	45,000
૧૫% ડિબેન્ચર	60,000	60,000	દેવાદારો	90,000	75,000
લેણદારો	4800	6000	લેણીદૂડી	6000	9000
દેવીદૂડી	2400	3600	રોકડ/બેંક	12000	15000
પ્રોવિડન્ટ ફંડ	4800	2400	પ્રાથમિક ખર્ચ	600	600
કરવેરા જોગવાઈ	6000	3000			
બેંક ઓવરડ્રાફ્ટ	1200	1500			
	3,18,600	3,54,600		3,18,600	3,54,600

વધારાની માહિતી :

વિગત

2015

2016

કુલ વેચાણ (રોકડવેચાણ, ઉધાર વેચાણના 60% છે)

3,00,000

3,75,000

કાચો નફો

60,000

90,000

વ્યાજ અને કરવેરા પહેલા નફો

81,000

93,000

શરૂઆતનો સ્ટોક (01-01-2015)

18,000

કરવેરાનો દર 50% , વર્ષના દિવસો 300 ગણવા.

ઉપર ની માહિતી પરથી બંને વર્ષ માટે નીચેના ગુણોત્તરો ગણો.

(૧) ચાલુ ગુણોત્તર

(૨) દેવાદાર ગુણોત્તર

(૩) સ્ટોક ગુણોત્તર

(૪) ચોખ્ખા નફાનો ગુણોત્તર

(૫) રોકાયેલી મૂડી પર વળતરદર

—X—

(૩)